Suzlon Energy Ltd.

One Earth, Hadapsar, Pune - 411 028, India



Phone : +91.20.61356135 / 67022000 Fax : +91.20.67022100 / 67022200

E-mail: pune@suzlon.com URL: www.suzlon.com

9th December 2023.

National Stock Exchange of India Limited, "Exchange Plaza", Bandra-Kurla Complex, Bandra (East), Mumbai-400051. **BSE Limited** P.J. Towers, Dalal Street, Mumbai-400001.

Dear Sirs,

Sub.: Second Reminder-Cum-Forfeiture Notice to the holders of partly paid-up equity shares, on which call money is to be paid, of Suzlon Energy Limited (the 'Company').

Ref.: Regulation 30 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

This has reference to First and Final Call Money of Rs.2.50 (comprising Re.1.00 towards face value and Rs.1.50 towards securities premium) per partly paid-up equity share ("Rights Equity Shares"), which were allotted by the Company on 31st October 2022, on a rights basis, pursuant to the Letter of Offer dated 28th September 2022 read with addendum dated 10th October 2022 ("Letter of Offer").

In this connection, the Securities Issue Committee of the Board of Directors of the Company (the "Committee"), duly authorised by the Board of Directors of the Company, at its meeting held on 29th March 2023, approved sending Reminder-cum-Forfeiture Notice from time to time for payment of the First and Final Call Money to the holders of such partly paid-up equity shares on which the First and Final Call Money remains unpaid. Accordingly, the Company has sent the Second Reminder-cum-Forfeiture Notice to the shareholders who have not paid the call money. A specimen copy of the Second Reminder-cum-Forfeiture Notice is enclosed herewith for your reference.

Further, the Company has, on 9th December 2023, also published an advertisement regarding the Second Reminder-cum-Forfeiture Notice in all the editions of English national daily newspaper, "Financial Express", all the editions of Hindi national daily newspaper, "Jansatta", and Ahmedabad edition of Gujarati newspaper, "Jai Hind". We hereby submit the copy of the said Advertisement(s) in 'pdf' format.

This is for your information as also for the information of your members and the public at large.

Thanking you,

Yours faithfully, For Suzlon Energy Limited

Geetanjali S.Vaidya, Company Secretary.

Encl.: As above.

FINANCIAL EXPRESS

MONETARY POLICY

RUPEE SLIDES TO CLOSE AT 83.39

Yields flat as traders shrug off RBI policy

DHARAMRAJ DHUTIA Mumbai, December 8


GOVERNMENT INDIAN **BONDS** continued to trade sideways on Friday, with yields in a narrow range as the Reserve Bank of India's last monetary policy decision for 2023 held no surprises.

The Indian central bank's key lending rate was kept steady, in line with a Reuters poll, with inflation control remaining a major focus amid expectations of a spike in food prices in coming months and better-than-expected economic growth.

The RBI refrained from any major announcements - unlike in August and October - while governor Shaktikanta Das said liquidity situations in the last two months did not warrant open market sale of bonds.

The 10-year benchmark bond yield was at 7.2375% as of 11:00 am, after ending the previous session at 7.2382%. It traded in a narrow three-basispoints range so far on Friday.

"There is absolutely nothing that can lead to a major **NO SURPRISES**



move in bonds for today and even the comment on OMO is not providing any clarity and we will have to wait for media interaction to get more insight," a trader with a private bank said.

India's economy grew 7.6% in the July-September quarter, much faster than the polled median of 6.8% and RBI's estimate of 6.5%, helped by government spending and manufacturing, raising bets that Asia's third-largest economy will outperform its own estimates for the full year.

Retail inflation is expected to rise for November as well as December, which may have nudged the central bank to remain cautious, traders have

7.27

Close

Kotak Mahindra Bank now expects a prolonged pause from the central bank.

added.

Traders will now also focus on demand for fresh supply at an auction, as New Delhi is set to raise ₹390 billion (\$4.68 billion) via sale of bonds, which includes ₹50 billion of 10-year green bonds.

— REUTERS

RBI moots forming fintech repository

FE BUREAU Mumbai, December 8

THE RESERVE BANK of India (RBI) has proposed setting up a fintech repository to capture key information about fintechs, which will encompass activities, products, technology stack and financial information about these

The fintech companies. repository will "Financial entities like banks and encompass NBFCs in India are activities, increasingly partproducts, nering with fintechnology stack

and financial information about companies

and to support this sector, it is proposed to set-up a fintech repository," governor Shaktikanta Das said in his monetary policy statement on Friday.

techs. For better

understanding of

developments in

fintech ecosystem

In its press release, the RBI urged fintechs to provide relevant information voluntarily to the repository. This will help these entities in designing appropriate policy approaches. The repository will be operationalised by the Reserve Bank Innovation Hub in April 2024 or earlier, the RBI said.

The central bank will issue necessary guidelines for this repository separately.

"The approach to encouraging voluntary contributions from fintechs will empower regulators with real-time insights and enable informed, agile and risk-mitigating decision-making," said Anand

> Agrawal, founder and chief product and technology officer, Credgenics. **Cloud facility**

for financial sector data in the works

The RBI is also

working on establishing a cloud facility for the financial sector in India. The proposed facility will help enhance the security, integrity and privacy of key data, the RBI said. It would also facilitate better scalability and business continuity.

The RBI's move comes when banks and financial entities are witnessing a rising volumes of data and many of these financial services entities are utilising the cloud facilities for this purpose.

Traders see relief as RBI tones down on bond sale

SUBHADIP SIRCAR & MALAVIKA KAUR MAKOL December 8

TRADERS ARE BETTING the central bank may refrain from doing bond sales in coming months after the monetary authority indicated a reduced need to deploy the tool.

Reserve Bank of India governor Shaktikanta Das on Friday said that liquidity tightened more than envisaged in the last policy, and thus the need for such debt sales hasn't arisen. Das shocked the markets in October by suggesting the RBI may do open-market bond sales, fuelling the biggest rout in a year. The option of doing OMO sales remains open if and when required, Das said in a post-policy briefing.

The 10-year yield can drop to 7.05% by March. "The unexpected change in liquidity situation due to various factors mentioned by RBI, the OMO sales seem unlikely now and even in the last quarter of FY24," said Abhisek Bahinipati, fixed-income trading head at Mirae Asset Capital Markets **— BLOOMBERG**

to keep the repo rate

unchanged at 6.50% was cau-

tious in keeping with the frag-

ile global economic environ-

ment and inflation being

above the central bank's com-

"With the taming of infla-

Unmesh Kulkarni, MD and

tion, we expect a reduction in

the interest rates in the com-

senior advisor, Julius Baer

India, a wealth management

firm, said that the RBI would

likely use its liquidity manage-

ment tools to keep inflation

under check than hike the repo

cerns and focus around

inflation, we are unlikely to see

any reversal in policy rates any-

time soon, at least till mid-

"Given the continued con-

rate any time soon.

2024," he said.

ing quarters," Agarwal said.

fort level of 4%.

(₹ cr)

Dream run:

SIP CONTRIBUTION

SIP inflows top

₹17,000 crore

SIDDHANT MISHRA

Mumbai, December 8

2022

Source: AMFI

SYSTEMATIC INVESTMENT **PLANS** (SIPs) continued their dream run in November, with contributions crossing ₹17,000 crore for the first time.

While the monthly contribution set a new record of ₹17,073 crore, the SIPAUM (assets under management) also touched a new high of ₹9.3 trillion, compared with ₹8.6 trillion in October, data from the Association of Mutual Funds in India (Amfi) showed on Friday. Net inflows into open-

ended equity schemes fell to ₹15,536 crore, compared with ₹19,957 crore in October. Inflows into largecap funds were in the positive territory, but dropped to ₹307 crore.

"Flows in this category have by and large been disappointing over the year as investors have perhaps opted for investing in this segment passively via index funds and the ETF route given their low cost," said Melvyn Santarita, analyst, Morningstar Investment Research India.

Smallcap funds remained the prime pick for investors,

with ₹3,700 crore coming in, while midcaps also showed healthy inflows of ₹2,666

Retail AUM (equity, hybrid, and solution-oriented schemes) stood at ₹27 trillion as of November-end, with an averageAUM of ₹26.4 trillion during the month. Open-ended debt

schemes, however, saw erosion of ₹4,706 crore. The money market category saw ₹865 crore of net inflows while the long duration funds witnessed a mere ₹87 crore in net inflows. Most of the debt schemes saw net outflows.

In October, the debt category had witnessed ₹42,634 crore in net inflows, with liquid funds being the biggest beneficiary.

"Since the revision of tax laws, investments in fixed income funds have notably subdued. The uncertainty surrounding interest rates has further complicated investment decisions for investors. Moreover, the robust performance of equity markets has been drawing increased attention from investors," said Himanshu Srivastava, associate director - manager research, Morningstar India.

Rate pause may spur demand, says India Inc

VIVEAT SUSAN PINTO, SWARAJ BAGGONKAR & RAJESH KURUP Mumbai, December 8

THE CENTRAL BANK'S decision to keep the repo rate unchanged at its bi-monthly meeting on Friday may encourage potential buyers of homes, cars and durable products to take the sales plunge, executives at top companies said.

"Today's RBI monetary policy announcement is a good boost to industry confidence. The upward revision of GDP growth rate, the holding of the repo rate and maintaining the inflation outlook will further reinforce confidence in the ecosystem for the year ahead," Shashank Srivastava, senior executive officer, sales and marketing, Maruti Suzuki

Name of the Target Company (TC)

Name of the Manager to the offer

Members of the Committee of Independent Directors

IDC Member's relationship with the TC (Director,

Equity shares owned, any other contract/

Trading in the Equity shares/ other

Securities of the TC by IDC Members.

9. IDC member's relationship with the acquirer

(Director, Equity shares owned any other contract

Trading in the Equity shares/ other Securities of

as to whether the offer is fair and reasonable

Details of the Offer pertaining to TC

Name of the Acquirer

relationship), if any.

relationship), if any.

the acquirer by IDC Members

12. Summary of recommendation

13. Disclosure of Voting Pattern

Date: 08th December, 2023

i Place: Kolketa Linancia lexp. epapr. in

14. Details of Independent Advisors, if any 15. Any other matter(s) to be highlighted

Recommendation on the Open offer,

India, said.

According to the Federation of Automobile Dealers Associations (FADA), November saw the highest-ever vehicle sales in history of the Indian automotive industry. Customers across various segments and categories purchased a total of 28.54 lakh units, surpassing the previous record of 25.69 lakh units set in March 2020.

The same goes for consumer durables, which saw a good festive season this year. A stable interest rate environment would only aid the growth of the market further, said Eric Braganza, former president of the Consumer Electronics and Appliances Manufacturers Association (CEAMA).

"The move to keep the repo rate unchanged will spur demand," Braganza said. "The

Recommendations of the Committee of Independent Directors ("IDC") on the Open Offer to the shareholders of Standard

Shoe Sole and Mould (India) Limited ("Target Company") under Regulation 26(7) of Securities and Exchange Board of India

08th December, 2023

Buildox Private Limited

Tel: 022-26378100

Fax: +91 22 2282 6580 E-mail: capital@afcogroup.in Website: www.afcogroup.in

Bal Kishan Das - (Chairman)

Rajiv Issar - (Member)

NotApplicable.

all material respect, true and correct and not misleading, whether by omission of any information or otherwise, and includes all the

AFCO Capital India Private Limited

Andheri (West), Mumbai-400053

SEBI Registration Number; INM000012555

Standard Shoe Sole and Mould (India) Limited

The Open Offer is made by the Acquirers in terms of Regulations 3(2) and

3(3) of SEBI (SAST) Regulations for acquisition of up to 1347190 (thirteen

lakhs forty-seven thousand one hundred & ninety only) fully paid-up equity

Seventy-Five Paise Only) per equity share from the public shareholders of

shares representing 26% of the Equity Share Capital of the Target

604-605, Cosmos Plaza, J.P Road, Near D.N Nagar Metro Station,

All the members of the IDC are the Non-Executive and Independent

Directors on the Board of the Target Company. None of the members of

Company at an Offer Price of Rs. 5.75/- (Rupees Five and

the Target Company in terms SEBI (SAST) Regulations.

(Substantial Acquisition of Shares and Takeovers) Regulations, 2011 ("SEBI (SAST) Regulations")

SHASHANK SRIVASTAVA, Senior executive officer, sales &

marketing, Maruti Suzuki India Upward revision of GDP growth rate... and maintaining inflation outlook will reinforce confidence in the ecosystem for the year ahead

> economy is on a good growth trajectory. The festive season has been good for the consumer durables industry, especially, premium products. This momentum will continue into the next year," he said.

The rate pause, said some

ANUJ PURI, Chairman, Anarock Group

The housing market is on a bull run and with soaring home prices, unchanged home loan rates will give some relief to homebuyers

experts, may help real estate developers plan their launches more confidently, as sentiment remains positive among

"If we consider the present trends, the housing market is on a bull run and unchanged

home loan rates will only add to the overall positive consumer sentiment. Given that housing prices have escalated in the last one year, at least the unchanged home loan rates will give some relief to homebuyers," Anuj Puri, chairman, Anarock Group, said. "The stable interest rate

outlook of the RBI will bode well for both residential and commercial real estate markets. The unchanged repo rate will enable individuals and businesses to purchase properties at a more affordable price, stimulating demand velocity," Niranjan Hiranandani, founder & MD, Hiranandani Group and national chairman of NAREDCO, an industry body, said.

Essar MD & CEO Rajiv Agarwal said that the RBI's decision

SUZLON POWERING A GREENER TOMORROW

SUZLON ENERGY LIMITED

Registered Office: "Suzlon", 5, Shrimali Society Near Shri Krishna Complex, Navrangpura, Ahmedabad 380 009, Gujarat, India; Tel: +91 79 6604 5000 Corporate Office: One Earth, Hadapsar, Pune 411 028, Maharashtra, India; Tel: +91 20 6702 2000 Contact Person: Geetanjali S. Vaidya, Company Secretary and Compliance Officer

> E-mail: investors@suzlon.com; Website: www.suzlon.com Corporate Identity Number: L40100GJ1995PLC025447

This is only an Advertisement for the information purpose and not for publication, distribution, or release, directly or indirectly, in the United States of America or otherwise outside India. This is not an offer document. All capitalised terms used and not defined herein shall have the meaning assigned to them in the Letter of Offer dated 28th September 2022 read with addendum dated 10th October 2022 filed with BSE Limited ('BSE') and the National Stock Exchange of India Limited ('NSE'), the stock exchanges where the Equity Shares of the Company are presently listed (BSE and NSE hereinafter together referred to as the "Stock Exchanges") and Securities and Exchange Board of India ('SEBI').

SECOND REMINDER-CUM-FORFEITURE NOTICE TO THE HOLDERS OF PARTLY PAID-UP **EQUTIY SHARES ON WHICH CALL MONEY IS TO BE PAID (ISIN :IN9040H01011)**

In terms of provisions of the Companies Act, 2013 ('Act'), read with the relevant rules made thereunder, the First and Final Call Notice had been issued to such persons who were members of the Company on 2" March 2023, being the Record Date. The call payment period has since expired on 23" March 2023.

In this connection, the Securities Issue Committee of the Board of Directors of the Company (the "Committee"), duly authorised by the Board of Directors of the Company, at its meeting held on 29" March 2023, approved sending Reminder-cum-Forfeiture Notice from time to time for payment of the First and Final Call amount of ₹2.50 per partly paid-up equity share (comprising ₹1.00 towards face value and ₹1.50 towards securities premium), to the holders of such partly paid-up equity shares on which the First and Final Call Money remains unpaid.

Accordingly, the Company has sent the Second Reminder-cum-Forfeiture Notice to the shareholders who have not paid the call money.

The payment of the First and Final Call has to be made immediately but not later than 26th December 2023 using any of the following modes:

- a. For payment by net-banking / UPI through the R-WAP facility provided by KFin Visit weblink https://rights.kfintech.com/callmoney/ and proceed to make payment. Kindly note that the interest amount is pre-computed when you make payment through the R-WAP.
- b. For payment through DD, the details are as under:
 - DD to be drawn in favour of: SUZLON ENERGY LIMITED RIGHT ALLOTMENT ACCOUNT
 - ii. DD payable at: Hyderabad or at par
 - iii. DD to be accompanied by Payment Slip containing details such as Name, DPID-Client ID, No. of shares, Amount, DD date and Number, Name of Bank
 - iv. DD along with the payment slip to be sent to: KFin Technologies Limited, (Unit: Suzlon Energy Limited), Selenium Tower B, Plot No.31 and 32, Financial District, Nanakramguda, Rangareddi-500032, Telangana, India.

The payment slip and detailed instructions for payment of Call Money are available on the website of the Company at www.suzlon.com and / or on web link of Kfin Technologies Limited at https://rights.kfintech.com/callmoney/. Please read the same carefully before proceeding for payment.

Please note that, failure to pay the First and Final Call Money, as aforesaid, shall render the partly paid-up equity shares of the Company, including the amount already paid thereon, liable to be forfeited in accordance with the provisions of the Act, the Articles of Association of the Company and the Letter of Offer, Further, interest @ 8.00 % (Eight per cent only) p.a. will continue to be charged for delay in payment of the First and Final Call from 24" March 2023 till date of the actual payment of the First and Final Call. The Company shall be entitled to deduct from any dividend payable to such members, if any, all sums of money outstanding on account of calls and interest due thereon in relation to the partly paid-up equity shares of the Company.

All correspondence in this regard may be addressed to: KFin Technologies Limited, Unit: Suzlon Energy Limited, Selenium Tower B, Plot No.31 and 32, Financial District, Nanakramguda, Rangareddi-500032, Telangana, India; Contact person: Mr. M. Murali Krishna Tel: +91 40 6716 2222; Toll Free No. 1800 309 4001 (operational from Monday to Saturday between 9 a.m. and 5 p.m.) E-mail id: einward.ris@kfintech.com.

> For Suzlon Energy Limited Sd/-Geetanjali S.Vaidya,

CHAIRMAN - COMMITTEE OF INDEPENDENT DIRECTORS

the IDC hold any equity shares or other securities of the Target Company and they do not have any other contract / relationship with the Target

None of the IDC members have traded in the Equity Shares/ other securities of the Company during the: Twelve months preceding the date of the PA.

Period from the date of the PA till the date of this recommendation. None of the IDC members have any contracts / relationship with the Acquirers.

The members of the IDC have perused the Offer documents namely: Public Announcement dated August 01, 2023 ("PA")

Detailed Public Statement published on August 08, 2023 ("DPS"). Draft Letter of Offer dated August 17, 2023 ("DLoF") Letter of Offer dated December 07, 2023 ("LoF").

On perusal of the aforesaid offer documents, the IDC members are of the opinion that the offer is fair and reasonable in terms of SEBI (SAST) 1) Based on the review of the offer documents, the member of IDC

recommends that the Offer price is justified in terms of the parameters under Regulations 8(1) and 8(2) of the SEBI (SAST) Regulations. Keeping in view that the offer price of Rs. 5.75/- (Rupees Five and Seventy-Five Paise Only) payable in cash per Equity Share to the Public Shareholders of the Target Company for this Offer is fair and reasonable. The Open Offer is in the interest of the Public Shareholders as it will provide them an opportunity to exit from the Target Company at a price determined in accordance with the SEBI (SAST) Regulations. However, the Public Shareholders should independently evaluate the Offer and take

informed decision in their best interest about tendering the Equity shares held by them in the Open Offer. The recommendations were unanimously approved by the members of IDC. None To the best of our knowledge and belief, after making proper enquiry, the information contained in or accompanying this statement, is in

information required to be disclosed by the Target Company under SEBI (SAST) Regulations. For and on behalf of Committee of Independent Directors of STANDARD SHOE SOLE AND MOULD (INDIA) LIMITED

> Sd/ **BAL KISHAN DAS** Place: Pune

Date: 8th December 2023

Company Secretary.

मांग



1) ऑफर दस्तावेजों की समीक्षा के आधार पर, आईडीसी के सदस्य ने सिफारिश की 12 सिफारिश का सारांश है कि सेबी (एसएएसटी) विनियमों के विनियम 8(1) और 8(2) के तहत मापदंडों के संदर्भ में ऑफर मुल्य उचित है। 2) यह ध्यान में रखते हुए कि प्रस्ताव मुल्य रु. 5.75/- (केवल पांच रुपये और पचहत्तर पैसे) इस ऑफर के लिए लक्षित कंपनी के सार्वजनिक शेयरधारकों को प्रति इक्विटी शेयर नकद भूगतान योग्य निष्पक्ष और उचित है। 3) ओपन ऑफर सार्वजनिक शेयरधारकों के हित में है क्योंकि यह उन्हें सेबी (एसएएसटी) विनियमों के अनसार निर्धारित मल्य पर लक्षित कंपनी से बाहर निकलने का अवसर प्रदान करेगा। हालाँकि, सार्वजनिक शेयरधारकों को स्वतंत्र रूप से ऑफर का मुल्यांकन करना चाहिए और ओपन ऑफर में उनके द्वारा रखे गए इक्विटी शेयरों

का सेबी (एसएएसटी) विनियमों के तहत लक्षित कंपनी द्वारा खलासा किया जाना आवश्यक है।

वोटिंग पैटर्न का खलार

दिनांक: 08 दिसंबर, 2023

स्थानः कोलकाता

14 स्वतंत्र सलाहकारों का विवरण, यदि कोई हो। 15. कोई अन्य मामले जिसे उजागर किया जाना है कोई नहीं हमारे सर्वोत्तम ज्ञान और विश्वास के अनुसार, उचित जांच करने के बाद, किसी भी जानकारी के विलोपन या अन्यथा विधि से इस कथन में या इसके साथ मौजूद जानकारी, सभी तात्विक दृष्टि से सत्य और सही है तथा भ्रामक नहीं है, और इसमें सभी अपेक्षति जानकारी

> स्टैंडर्ड शु सोल एंड मोल्ड (इंडिया) लिमिटेड के स्वतंत्र निदेशकों की समिति के लिए और उसकी ओर से

3. प्रस्ताव का प्रारूप पत्र दिनांक 17 अगस्त2023 ('डीएलओएफ')

ऑफर सेबी (एसएएसटी) विनियमों के संदर्भ में उचित और उचित है।

को टेंडर करने के बारे में अपने सर्वोत्तम हित में सुचित निर्णय लेना चाहिए।

आईडीसी के सदस्यों द्वारा सिफारिशों को सर्वसम्मति से अनुमोदित किया गया।

उपरोक्त प्रस्ताव दस्तावेजों के अवलोकन पर, आईडीसी सदस्यों की राय है कि यह

4. प्रस्ताव पत्र दिनांक ०७ दिसंबर,२०२३ ('एलओएफ')।

अध्यक्ष - स्वतंत्र निदेशकों की समिति

CORRIGENDUM TO THE DETAILED PUBLIC ANNOUNCEMENT DATED NOVEMBER 21, 2023, AND THE LETTER OF OFFER DATED NOVEMBER 21, 2023 FOR THE ATTENTION OF THE PUBLIC SHAREHOLDERS OF



THAMBBI MODERN SPINNING MILLS LIMITED

Corporate Identification Number (CIN): L17111TZ1977PLC000776 Registered Office: Omalur Road, Jagir Ammapalayam, Salem - 636 302, Tamil Nadu, India; Tel. No.: +91 427 234 5425; Fax: N.A; Contact Person: Ms. M Uma Maheshwari, Company Secretary & Compliance Officer;

Email id: tmsml@ymail.com; Website: www.thambbimodern.com

This Corrigendum to the Detailed Public Announcement and the Letter Of Offer, dated December 08, 2023 ("Corrigendum") is being issued by Saffron Capital Advisors Private Limited ("Manager to the Offer") for and on behalf of Mr. Ramasamy Udayar Jagadeesan ("Promoter Acquirer"), to the public shareholders of Thambbi Modern Spinning Mills Limited ("Company") in respect of the acquisition of up to 28,84,950 (Twenty Eight Lakhs Eighty Four Thousand Nine Hundred And Fifty) ("Offer Shares") equity shares of face value of Rs.10/- each ("Equity Shares") representing 25.03% of the paid up Equity Share Capital of the Company and consequent voluntary delisting of the Equity Shares of the Company from the BSE Limited ("BSE"), the only Stock Exchange where the Equity Shares of the Company are presently listed, pursuant to applicable provisions of the SEBI Delisting Regulations ("Delisting Offer") and in accordance with the terms and conditions set out in the Initial Public Announcement dated July 14, 2023 ("IPA"), the Detailed Public Announcement dated November 21, 2023 published on November 22, 2023 ("DPA") in Financial Express (English-All Editions), Jansatta (Hindi – All Editions) and Pratahkal (Marathi – Mumbai Edition) and the Letter Of Offer dated November 21, 2023 ("LOF")

The Promoter Acquirer vide his letter dated December 06, 2023, had requested SEBI to extend the Bidding period due to extreme cyclonic, flood situation in Chennai and nearby areas of Tamil Nadu. Further SEBI vide its email dated December 08, 2023, has provided extension in Bidding period by 3 (Three) working days and the Bid Closing date has now been revised from Friday, December 08, 2023, to Wednesday, December 13, 2023. This Corrigendum is being published in all the newspapers in which the DPA was published. Public Shareholders are requested to kindly refer to below revised schedule of activities for the Delisting

Capitalized terms used but not defined in this Corrigendum shall have the same meaning as assigned to them in the LOF.

Activity	Original Schedule (Day and Date)	Revised Schedule (Day and Date)
Initial Public Announcement	Friday, July 14, 2023	Friday, July 14, 2023
Resolution for approval of the Delisting Proposal passed by the board of directors the Company	Wednesday, August 02, 2023	Wednesday, August 02, 2023
Resolution for approval of the Delisting Proposal passed by the Shareholders the Company	Friday, September 8, 2023	Friday, September 8, 2023
Date of receipt of the BSE in-principle approval	Tuesday, November 21, 2023	Tuesday, November 21, 2023
Date of publication of Detailed Public Announcement	Wednesday, November 22, 2023	Wednesday, November 22, 2023
Specified Date for determining the names of the Shareholders to whom the Letter of Offer shall be sent*	Tuesday, November 21, 2023	Tuesday, November 21, 2023
Last date for dispatch of the Letter of Offer and Bid Forms to the Public Shareholders as on Specified Date**	Friday, November 24, 2023	Friday, November 24, 2023
Last date for Publication of recommendation by Independent Directors of the Company**	Thursday, November 30, 2023	Thursday, November 30, 2023
Bid Opening Date (bid starts at market hours)	Monday, December 04, 2023	Monday, December 04, 2023
Last date for revision (upwards) or withdrawal of Bids	Thursday, December 07, 2023	Tuesday, December 12, 2023
Bid Closing Date (bid closes at market hours)	Friday, December 08, 2023	Wednesday, December 13, 2023@
Last date for announcement of counter offer	Tuesday, December 12, 2023	Friday, December 15, 2023
Last date of announcement of the Discovered Price or Exit Price and the Promoter Acquirer Acceptance/ Rejection of the Discovered Price/Exit Price#	Tuesday, December 12, 2023	Friday, December 15, 2023
Proposed date for payment of consideration if Exit Price is higher than the Indicative Price#	Tuesday, December 19, 2023	Friday, December 22, 2023
Last date for return of the Equity Shares to the Public Shareholders in case of Bids not being accepted / failure of the Delisting Offer	Tuesday, December 12, 2023	Friday, December 15, 2023
* The Consilled Date is only for the aurence of date min	ing the assess of the Dublic Character	I the state of the state of Office 19

* The Specified Date is only for the purpose of determining the names of the Public Shareholders to whom the Letter of Offer will be sent. However, all Public Shareholders (registered or unregistered) of the Company are eligible to participate in the Delisting Offer on or before the Bid Closing Date.

** Such activity may be completed on or before the last date.

Subject to acceptance of the Discovered Price or offer of an Exit Price higher than the Discovered Price by the Promoter

@Last date of Bid Closing has been extended vide SEBI email dated December 08, 2023. Manager to the Offer Registrar to the Offer

• • • • energising ideas

SAFFRON CAPITAL ADVISORS PRIVATE LIMITED 605, 6th floor, Centre Point, Andheri Kurla Road, J.B. Nagar, Andheri (East) Mumbai - 400 059,

Contact Person: Ms. Pooja Jain/Mr. Saurabh Gaikwad

Maharashtra, India. Tel. No.: +91 22 4973 0394; Fax: N.A. Website: www.saffronadvisor.com

E-mail id: delistings@saffronadvisor.com Investor grievance id: investorgrievance@saffronadvisor.com Validity of Registration: Permanent



CAMEO CORPORATE SERVICES LIMITED Subramanian Building", No.1, Club House Road, Chennai - 600 002,

Tamil Nadu, India Tel. No.: +91 44 4002 0700; Fax: N.A.

Email id: investor@cameoindia.com Website: www.cameoindia.com Investor grievance id: investor@cameoindia.com Validity of Registration: Permanent Contact Person: Ms. Sreepriya K SEBI Registration Number: INR000003753

पंजीकृत कार्यालय : एक्सप्रेस बिल्डिंग, तृतीय तल, 9-10, बहादर शाह जफर मार्ग, नई दिल्ली-110002, टेलीफोन : सूचना +91 11 41204444, फैक्स : +91 11 41204000, ई-मेल :dmi@dmihousingfinance.in, U65923DL2011PTC216373 जबकि वहां उल्लेखित ऋणियों/सह -ऋणियों/जमानतदारों/बंधककर्ताओं ने डीएमआई हाउसिंग फाइनेंस प्राइवेट लिमिटेड से वित्तीय सहायता प्राप्त की थी। हम बताते हैं कि वितीय सहायता प्राप्त करने के बावजूद, ऋणियों/जमानतदारों/वंधककर्ताओं ने देय तिथियों के अनुसार ब्याज और मुलधन की अदायगी में विभन्न चुक की हैं। डीएमआई हाउसिंग फाइनेंस प्राइवेट लिमिटेड के प्राधिकृत अधिकारी के परिणामस्वरूप वित्तीय आस्तियों के प्रतिभृतिकरण और पुनर्गठन तथा प्रतिभृति हित का प्रवर्तन अधिनियम 2002 के तहत भारतीय रिजर्व बैंक द्वारा जारी किए गए निर्देशों / दिशानिर्देशों के अनुसार खाते को गैर निष्पादित संपत्ति के रूप में वगीकृत किया गया है। प्रतिभृति हित (प्रवर्तन) अधिनियम, 2002 के नियम 3 के साथ पठित धारा 13(12) के तहत प्रदत्त शक्तियों का प्रयोग करते हुए सरफेसी अधिनियम, 2002 की धारा 13(2) के तहत नीचे

याज	r, आकरिमक व्यव, लागत, शुल्क आदि के साथ नोटिस प्राप्त करने की तारीख से	60 दिनों के भीतर चुकाने के	लिए कहा जाता है।		
क्र. सं.	ऋणियों का नाम व पता	सम्पत्ति का विवरण	ऋण राशि (रूपये)	बकाया राशि (रूपये)	नोटिस दिनांक
"	 जयवीर सिंह पुत्र मदनपाल राखी पत्नी जववीर सिंह दोनों निवासी- मकान नं. 3350, मोहह्रा जटवाडा, कृचा तारा चंद दस्यागंज, 	खसरा नंबर 245/1, ुन्यू आनंद विहार	₹. 11,45,699/-		17/11/2023
	गोलचा सिनेमा के पास, नई दिल्ली 110002, यहां भी:- खदीजा नेजनल हॉस्पिटल 3123, तिराहा बेहरम खान, सर सैबद अहमद रोड, गोलचा सिनेमा के पास, सेंट्रल दिल्ली, नई दिल्ली 110002, वहां भी:- 3123, तिराहा बेहरम खान, सर सैबद अहमद रोड, गोलचा सिनेमा के पास, सेंट्रल दिल्ली, नई दिल्ली 110002, वहां भी:- खसरा नंबर 245/1, न्यू आनंद बिहार कॉलोनी में स्थित, ग्राम सादकाबाद प्रकार एवं तकसील लोगी जिला गाजिबाबाद उत्तरप्रदेश 201102	कालाना म स्थित, ग्राम सादुद्धावाद, परगना एवं तहसील लोनी, जिला	ऋण खाता संख्या HFC0003 016283	नवम्बर, 2023 तक उपार्जित ब्याज, अन्य बकाया एवं शुल्क शामिल है।	एनपीए दिनांक 03/11/2023

उल्लेखित संबंधित तिथियों पर मांग नोटिस जारी किया गया जिसमें निम्नलिखित ऋणियों/ गारंटरों/बंधककर्ताओं से नोटिस में उद्विखित राशि + अनुबंध की दर पर अतिरिक्त

डीएमआई हाऊसिंग फाइनेन्स प्राइवेट लिमिटेड

इपया ध्यान दें कि उक्त अधिनियम की धारा 13(13) के तहत, कोई भी ऋणी प्रतिभृत लेनदार की पूर्व लिखित सहमति के विना नोटिस में निर्दिष्ट अपनी किसी भी प्रतिभृति आस्ति को विक्री, पट्टे या अन्य के माध्यम से स्थानांतरित नहीं करेगा।

स्थानः दिल्ली एनसीआर वास्ते डीएमआई हाउसिंग फाइनेंस प्राईवेट लिमिटेड, दिनांकः 08.12.2023 प्राधिकृत अधिकारी

बनान फाइनेंस लिमिटेड नियमित कार्यालय : व्रतीय तल, बजाज फिनसर्व, पंचतील टेक पार्क, विमान नगर, पुणे, महाराष्ट्र, भारत-411014

शाखा कार्यालय : एससीओ 91 गणपति टॉवर, प्रथम तल, बैंक ऑफ बढ़ौदा के क्रयर, प्रेम नगर, विशाल मेगा मार्ट के समीप, अंबाल सिटी-134003 विलीय परिसंपत्तियों के प्रतिभृतिकरण एवं प्रनर्मिर्माण तथा प्रतिभृति हित प्रवर्तन अधिनियम 2002 की धारा 13(2) के अंतर्गत मांग सूचना।

अधोहस्ताक्षरकर्ता. मैंसर्स बजाज फाइनेंस लिमिटेड के प्राधिकत अधिकारी के रूप में एतदहारा उन ऋणधारक(की) / सह—ऋणधारक(के)) को निम्नलिखित सचना प्रेषित करते हैं ज अपने दायित्व का निर्वहन करने में विफल हो चके हैं अर्थात बजाज फाइनेंस लिमिटेड द्वारा उन्हें दिये गये संपत्ति अग्रिमों के समक्ष आवास ऋण(णीं) /ऋण(णीं) हेत उन पर प्रोदभूतकृत ब्याज एवं अन्य शुल्कों के साथ–साथ मूल धनराशि के प्रतिभुगतान में चूक कर चुके हैं तथा उसके परिणामस्वरूप ऋण(ऋणानेक) अनिधादनीय परिसंपत्तियां (एन.पी. १) बन चुके हैं। तदनुसार वित्तीय परिसम्पत्तियों के प्रतिभृतिकरण एवं पुनर्निर्माण तथा प्रतिभृति हित प्रवर्तन अधिनियम 2002 की धारा 13(2) तथा उसकी नियमावली के अंतर्गत उन्हें उनके अंतिम ज्ञात पतों पर सूचनाएं निर्गत की गयी थीं, परंतु वह सूचनावें उनको प्राप्त हुये बिना ही वापस लीट आयीं / उन्होंने सूचनायें प्राप्त नहीं कीं, और इसीलिए ऋणधारक(ऑ) / सह—ऋणधारक(कॉ) को एतदहारा इस प्रकाशन सूचेना के मध्यम से सुचित / संसुचित किया जाता है कि वे समय–समय पर अपने द्वारा प्राप्त की गयी ऋण सुविधाओं के अंतर्गत नियत बकाया देयराशियों का भूगतान पूर्ण करें।

प्रवर्तित की जानेवाली प्रतिभृत / कंवककृत अवल परिसंपतित /

मुघना आपको प्राप्त हो इस हेत् वैकल्पिक मार्ग देखे और अपनाये जा रहे हैं। उपरोक्त ऋणधारको तथा 🖊 अथवा सह-ऋणधारको एव गारटरो को सलाह है कि वे इस सुचना हे प्रकाशन की तिथि से 60 दिवसों की समयाविध के अंदर भावी ब्याज के साथ बकाया धनराशि का भूगतान कर दें। भूगतान करने में विफल रहने पर (बजाज फाइनेंस लिमिटेड 🕏 पास उपलब्ध किसी अन्य अधिकारगत उपचार के पूर्वाग्रह के बिना) प्रतिभृत परिसंपत्तियों 🖊 बंधककृत संपत्ति का अधिग्रहण करने के लिये वित्तीय परिसन्पत्तियों के प्रतिभूतिकरण एवं पुनर्निर्माण तथा प्रतिभूति हित प्रवर्तन अधिनियम 2002 की धारा 13(4) के प्रावधानों के अनुसार भावी कार्यवाहियां प्रारंभ की जायेंगी। उपरोक्त नामित पक्षकारों को यह सलाह भी है कि ऊपर वर्णित उन संपत्तियों में किसी तृतीय पक्ष का स्वत्यांतरण, हित सुजित न करें जिन पर बजाज फाइनेंस लिमिटेड का प्रभार हैं।

सीआईएन : L74899DL1992PLC050216 पंजी. कार्यालय : एच–1, जमरूदपुर सामुदायिक केन्द्र, कैलाश कॉलोनी, नई दिल्ली–110048 दूरभाष : 011-29241099, 41587085, 40587083, वेबसाइट : www.mescosteel.com

एतद्दवारा सुचना दी जाती है कि कंपनी के सदस्यों की 30वीं वार्षिक आम बैठक (एजीएम) वी कॉन्फ्रेंसिंग (''वीसी'') / अन्य ऑडियो–विज्अल माध्यमों (''ओएवीएम'') के माध्यम से शनिवार, 30 दिसंबर 2023 को पर्वाह्न 11.00 बजे आयोजित की जाएगी. जिसमें 30वीं एजीएम की सचना में निर्धारितानसा साधारण एवं विशेष व्यवसाय का लेन–देन किया जाना है, जो एमसीए द्वारा निर्गत सामान्य परिपत्र संख्या २/२०२२ एवं १९/२०२१, अन्य परिपत्रों तथा सेबी परिपत्र दिनांक १३ मई २०२३ के अनुपालन

में किया जाना है। एजीएम के लिये मानित स्थल कंपनी का पंजीकत कार्यालय होगा। वित्तीय वर्ष 2022-23 के लिए कंपनी की वार्षिक रिपोर्ट के साथ-साथ बैठक में संचालित किये जानेवाले व्यवसाय का निर्धारिण करनेवाली वाली 30वीं एजीएम की सूचना की इलेक्ट्रॉनिक प्रति, रिमोट ई—वोटिंग हेतू अनुदेशों सिहत, उन सदस्यों को भेज दी गई है, जिनके ई— मेल आईडी संचार के लिए कंपनी / डिपॉजिटरी प्रतिभागियों के पास पंजीकृत हैं। जिन लोगों ने अपनी ई–मेल आईडी पंजीकृत नहीं की है, वे वार्षिक रिपोर्ट 2023 की प्रति, कंपनी की वेबसाइट अर्थात www.mescosteel.com और स्टॉक एक्सचेंज की वेबसाइट अर्थात www.bseindia.com एवं एनएसडीएल की वेबसाइट www.evoting.nsdl.com से प्राप्त कर सकते हैं।

संशोधितानुसार सेबी (एलओडीआर) विनियमावली 2015 के साथ पठित कंपनी अधिनियम 2013 (अधिनियम) की धारा 91 के अनुसार, सदस्यों का रजिस्टर और कंपनी की शेयर हस्तांतरण पुस्तकें, 30वीं एजीएम के प्रयोजन के लिए रविवार 24 दिसंबर 2023 से लेकर के शनिवार 30 दिसंबर 2023 (दोनों दिन सम्मिलित) तक बंद रहेंगी।

कंपनी अधिनियम 2013 की धारा 108 तथा कंपनी (प्रबंधन और प्रशासन) संशोधन नियमावली 2015 द्वारा संशोधितानुसार कंपनी (प्रबंधन और प्रशासन) नियमावली 2014 के नियम 20 और संशोधित सेर्ब (सूचीबद्ध दायित्व और प्रकटीकरण आवश्यकताएँ) विनियमावली 2015 के विनियम 44 के अनुसार कंपनी अपने सदस्यों को इलेक्ट्रॉनिक माध्यमों (''रिमोट ई—वोटिंग'') से वोट देने के अपने अधिकार क प्रयोग करने की सुविधा प्रदान करके प्रसन्न है। कंपनी ने कंपनी के अपने सदस्यों को ई-वोटिंग सुविधा प्रदान करने के लिए नेशनल सिक्योरिटीज डिपॉजिटरी लिमिटेड (एनएसडीएल) की सेवाएं ली हैं। रिमोट ई—वोटिंग सुविधा बुधवार 27 दिसंबर 2023 को सुबह 9:00 बजे प्रारंभ होगी और शुक्रवार 29 दिसंबर 2021 को सायं 5:00 बजे समाप्त होगी। रिमोट ई—वोटिंग के लिए पूर्वोक्त तिथि एवं समय व अतिरिक्त अनुमति नहीं दी जाएगी। एक व्यक्ति, जिसका नाम कट—ऑफ तिथि, अर्थात् 24 दिसंबर 2023 के अनुसार सदस्यों / लाभार्थी स्वामियों के रजिस्टर में प्रविष्ट होता है, केवल वही बैठक में रिमोट ई—वोटिंग / वोटिंग की सुविधा प्राप्त करने का अधिकारी होगा।

एक व्यक्ति, जो बैठक की सूचना के प्रेषण के पश्चात कंपनी का सदस्य बनता है और कट—ऑफ तिथि के अनुसार शेयरों का धारण करता है, वह evoting@nsdl.co.in या admin@skylinerta.com पर एक अनुरोध भेजकर लॉगिन आईडी एवं पासवर्ड प्राप्त कर सकता है। यदि आप ई-वोटिंग के लिए पहले से ही एनएसडीएल के साथ पंजीकृत है तो आप अपने विद्यमान लॉगिन आईडी एवं पासवर्ड का अपना वोट डालने के लिए उपयोग कर सकते हैं।

जिन सदस्यों ने बैठक से पहले रिमोट ई-वोटिंग द्वारा अपना वोट डाला है वे बैठक में भाग ले सकते हैं किंतू उन्हें पूनः अपना वोट डालने का अधिकार नहीं होगा। किसी भी प्रश्न की स्थिति में, आप www.evoting.nsdl.com के डाउनलोड सेक्शन पर उपलब्ध शेयरधारकों के लिए अक्सर पूछे जाने वाले प्रश्न (एफएक्यू) और शेयरधारकों के लिए ई–वोटिंग उपयोगकर्ता पुस्तिका का संदर्भ ले सकते हैं अथवा टोल फ्री नंबर : 1800–222–990 पर कॉल कर सकते हैं अथवा सूश्री पल्लवी महात्रे को evoting@nsdl.co.in पर एक अनुरोध भेज सकते हैं। निदेशक मंडल के आदेशानुसार

कृते मिडईस्ट इंटिग्रेटेड स्टील्स लिमिटेड

डीआईएन : 0008226

स्थान : नई दिल्ली दिनांक : 07-12-2023



ऋण खाता तं. / ऋणधारक(कों) / सह-ऋणधारक(कों) /

चोलामंडलम इन्वेस्टमेंट ऐण्ड फायनेंस कम्पनी लिमिटेड

कार्पेरिट कार्यालय : "चोला क्रेस्ट", सी 54 एवं 55, सुपर बी-4, थिरू वी का इंडस्ट्रियल एस्टेट, गिन्डी, चेन्नई-600032 ग्राखा कार्यालय : प्लॉट नंबर 5, पदम प्लाजा, एच-1 एवं २, तृतीय तल, सेक्टर-16 बीँ, आवास विकास कालोनी, सिकंदरा योजना, उत्तर प्रदेश-282 007, प्राधिकृत अधिकारी : जोगेन्द्र सिंह - 9557624991

अचल सम्पत्तियों की बिक्री के लिए ई—नीलामी बिक्री सूचना

वित्तीय आस्तियों का प्रतिभूतिकरण और पूनर्निर्माण तथा प्रतिभूति हित प्रवर्तन अधिनियम, 2002 के साथ पठित प्रतिभूति हित (प्रवर्तन) नियमावली, 2002 के नियम 9(1) के परंतुक के तहत अचल आस्तियों की बिक्री के लिए ई-नीलामी बिक्री सूचना।

एतदद्वारा सर्वसाधारण को और विशेष रूप से कर्जदार / सह–कर्जदार / बंधकदता(ओं) को सचना दी जाती है कि प्रतिभत लेनदार के पास बंधक निम्नवर्णित अचल सम्पत्तियां, जिनक सांकेतिक / भौतिक कब्जा चोलामंडलम इन्वेस्टमेंट ऐण्ड फायनैंस कम्पनी लिमिटेड इसमें आगे चोलामंडलम इन्वेस्टमेंट ऐण्ड फायनैंस कम्पनी लिमिटेड कही जाएगी, के प्राधिकृत अधिकारी द्वारा लिया जा चुका है। प्रतिभूत आस्तियां "जैसा है जहां है", "जो है जैसा है" तथा "जो भी है वहां हे" आधार पर ई—नीलामी के माध्यम से बेची जाएंगी। एतदद्वारा सर्वसाधारण को सूचना दी जाती है कि हम ई–नीलामी का संचालन वेबसाइट https://chola-lap.procure247.com/ के माध्यम से करेंगे।

- 1	क्र.	खाता संख्या तथा कर्जदार,	धारा 13(2) के तहत	सम्पत्ति / सम्पत्तियो	सुरक्षित मूल्य,	ई—नीलामी की तिथि एव समय,
п	सं.	सह–कर्जदार, बंधकदाताओं का नाम	मांग सूचना की	का वर्णन	धरोहर राशि जमा	ईएमडी जमा की अंतिम तिथि,
ı			तिथि एवं राशि		एवं बोली वृद्धि राशि	निरीक्षण की तिथि
П	1.	ऋण खाता सं. X0HEAHE00002836858 एवं X0HEAHE00002902851)	08-06-2021	सम्पत्ति के सभी अंश एवं खंड : प्लॉट नंबर 8,	(रु. में)	
П		1. अरूण कुमार पाठक	रू. 33,03,175.96 ∕ —	8ए, 8बी पर आवासीय मकान, नगर निगम नंबर		27-12-2023
- 1		2. माला पाठक	बकाया राशि	36/34एल/पी–8 जानकी पैलेस, मौजा उखर्रा,	TE 42 E2 E00 /_	पूर्वा. 11.00 बजे से अप. 01.00 बजे तक
- 1		3. शिव लता पाठक	षपगपा सारा	36/34९ल/पा–८ जानका पलस, माजा उखरा,	र्फ. 4,25,250 ∕ —	पूर्वा. 11.00 बड़ा से अव. 01.00 बड़ा राव
- 1		4. मैसर्स ए.एस. टिम्बर	रू. 51,11 671 ∕ —	तहसील एवं जिला आगरा, परिमाप 150 वर्ग	₹ 50,000 /—	26-12-2023
П		सभी का पता : 36/34/पी/8 जानकी पैलेस, देओरी रोड, आगरा,	08—12—2023 तक	मीटर, चौहद्दी — पूरब : 20 फीट रोड, पश्चिम	Vi. 30,000 /	पूर्वा. 10.00 बजे से अप. 05.30 बजे तक
П		उत्तर प्रदेश —282001	00 12 2020 (14)	ः एस.पी. सिंह का मकान, उत्तर ः उषा पांडे का		22-12-2023 एवं 23-12-2023
- 1		अन्य पता : 37ए/21/2, मधु नगर निकट लालबहादुर शास्त्री इंटर कालेज,				
- 1		आगरा—282001		मकान, दक्षिण : भगत सिंह का मकान		(पूर्वा. 10.00 बजे से अप. 1.00 बजे तक)

1. सभी इच्छुक प्रतिभागियों / बोलीदाताओं से वेबसाइट https://chola-lap.procure247.com/ एवं https://cholamandalam.com/auction-notices पर जाने का अनुरोध है। विस्तृत विवरण सहायता, प्रक्रिया और ई—नीलामी पर ऑनलाइन प्रशिक्षण के लिए बोलीदाता सम्पर्क करें (मुहम्मद रहीस – 81240 00030), Ms.procure247; (सम्पर्क व्यक्ति : करण मोदी : 70167 16557– karan@procure247.com, अपूर्व पटेल : 91061 96864— apurva@procure247.com, अल्पेश बोरिसा — alpesh@procure247.com 2. ई—नीलामी में भाग लेने के लिए नियम और शर्तों के बारे में अतिरिक्त विवरण के लिए कृपया https://chola-lap.procure247.com/ एवं https://cholamandalam.com/auction-notices

देखें। यह सूचना प्रतिभूति हित (प्रवर्तन) नियमावली, 2002 के नियम 9(1) के तहत बिक्री के संबंध में 15 दिन का कानूनी नोटिस भी है

हस्ता. / – प्राधिकृत अधिकारी, चोलामंडलम इन्वेस्टमेंट ऐण्ड फायनैंस कम्पनी लिमिटेड स्थान : आगरा दिनांक : 09-12-2023

> SUZLON POWERING A GREENER TOMORROW

SUZLON ENERGY LIMITED

Registered Office: "Suzlon", 5, Shrimali Society Near Shri Krishna Complex, Navrangpura, Ahmedabad 380 009, Gujarat, India; Tel: +91 79 6604 5000 Corporate Office: One Earth, Hadapsar, Pune 411 028, Maharashtra, India; Tel: +91 20 6702 2000 Contact Person: Geetanjali S. Vaidya, Company Secretary and Compliance Officer

E-mail: investors@suzlon.com; Website: www.suzlon.com

Corporate Identity Number: L40100GJ1995PLC025447

This is only an Advertisement for the information purpose and not for publication, distribution, or release, directly or indirectly, in the United States of America or otherwise outside India. This is not an offer document. All capitalised terms used and not defined herein shall have the meaning assigned to them in the Letter of Offer dated 28" September 2022 read with addendum dated 10" October 2022 filed with BSE Limited ('BSE') and the National Stock Exchange of India Limited ('NSE'), the stock exchanges where the Equity Shares of the Company are presently listed (BSE and NSE hereinafter together referred to as the "Stock Exchanges") and Securities and Exchange Board of India ('SEBI').

SECOND REMINDER-CUM-FORFEITURE NOTICE TO THE HOLDERS OF PARTLY PAID-UP **EQUTIY SHARES ON WHICH CALL MONEY IS TO BE PAID (ISIN :IN9040H01011)**

In terms of provisions of the Companies Act, 2013 ('Act'), read with the relevant rules made thereunder, the First and Final Call Notice had been issued to such persons who were members of the Company on 2[™] March 2023, being the Record Date. The call payment period has since expired on 23[™] March 2023.

In this connection, the Securities Issue Committee of the Board of Directors of the Company (the "Committee"), duly authorised by the Board of Directors of the Company, at its meeting held on 29th March 2023, approved sending Reminder-cum-Forfeiture Notice from time to time for payment of the First and Final Call amount of ₹2.50 per partly paid-up equity share (comprising ₹1.00 towards face value and ₹1.50 towards securities premium), to the holders of such partly paid-up equity shares on which the First and Final Call Money remains unpaid.

Accordingly, the Company has sent the Second Reminder-cum-Forfeiture Notice to the shareholders who have not paid the call money.

The payment of the First and Final Call has to be made immediately but not later than 26th December 2023 using any of the following modes:

- a. For payment by net-banking / UPI through the R-WAP facility provided by KFin Visit weblink https://rights.kfintech.com/callmoney/ and proceed to make payment. Kindly note that the interest amount is pre-computed when you make payment through the R-WAP.
- b. For payment through DD, the details are as under:
- DD to be drawn in favour of: SUZLON ENERGY LIMITED RIGHT ALLOTMENT ACCOUNT
- DD payable at : Hyderabad or at par

Date: 8th December 2023

- iii. DD to be accompanied by Payment Slip containing details such as Name, DPID-Client ID, No. of shares, Amount, DD date and Number, Name of Bank
- iv. DD along with the payment slip to be sent to: KFin Technologies Limited, (Unit: Suzlon Energy Limited), Selenium Tower B, Plot No.31 and 32, Financial District, Nanakramguda, Rangareddi-500032, Telangana, India.

The payment slip and detailed instructions for payment of Call Money are available on the website of the Company at www.suzlon.com and / or on web link of Kfin Technologies Limited at https://rights.kfintech.com/callmoney/. Please read the same carefully before proceeding for payment.

Please note that, failure to pay the First and Final Call Money, as aforesaid, shall render the partly paid-up equity shares of the Company, including the amount already paid thereon, liable to be forfeited in accordance with the provisions of the Act, the Articles of Association of the Company and the Letter of Offer. Further, interest @ 8.00 % (Eight per cent only) p.a. will continue to be charged for delay in payment of the First and Final Call from 24" March 2023 till date of the actual payment of the First and Final Call. The Company shall be entitled to deduct from any dividend payable to such members, if any, all sums of money outstanding on account of calls and interest due thereon in relation to the partly paid-up equity shares of the Company.

All correspondence in this regard may be addressed to: KFin Technologies Limited, Unit: Suzlon Energy Limited, Selenium Tower B, Plot No.31 and 32, Financial District, Nanakramguda, Rangareddi-500032, Telangana, India; Contact person: Mr. M. Murali Krishna Tel: +91 40 6716 2222; Toll Free No. 1800 309 4001 (operational from Monday to Saturday between 9 a.m. and 5 p.m.) E-mail id: einward.ris@kfintech.com.

For Suzlon Energy Limited

Geetanjali S.Vaidya, Company Secretary.

Ramasamy Udayar Jagadeesan (Promoter Acquirer)

Place: Pune

SEBI Registration Number: INM 000011211 Place: Salem Date: December 08, 2023 www.readwhere.com

પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાથી દેશમાં ઠંડી વધી

નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય, આસામમાં વરસાદની શક્ચતા

સતત ઘટાડો થઇ રહ્યો છે. યુપી, ખરાબ થઇ રહી છે. પંજાબ અને હરિયાણામાં પ્રદેશ, બિહાર, ઝારખંડમાં નોએડામાં

આગાહી કરી છે. મુજબ શુક્રવારે ૮મી ડિસેમ્બરના એક્ચુઆઇ નોંધાયુ હતું. રોજ મહત્તમ તાપમાન ૨૪ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રી આગામી ૨૪ કલાકમાં પૂર્વોત્તર

જોકે ભારતીય અર્થતંત્ર

સફળ : શહેરી માંગ

વધતા ગ્રામીણ ક્ષેત્રોને

પણ ફાયદો

વૈશ્વિક અર્થતંત્રમાં મંદીના સંકેત :

શક્તિકાંતા દાસનું મહત્વનું વિધાન

તેની ગતિ જાળવી રાખવા કે વૈશ્વિક અર્થતંત્રમાં મંદીના સંકેત

૫.૪ ટકાની આસપાસ રહી શકે છે અને અમારો લક્ષ્યાંક ૪ ટકાનો છે.

તેઓએ જણાવ્યું કે શહેરી માંગ વધી રહી છે અને તેના કારણે ગ્રામીણ

ક્ષેત્રમાં ફાયદો થઇ રહ્યો છે. ખાદ્ય ફુગાવાને કારણે આરબીઆઇ તેની

નવી દિલ્હી. તા.૮ ૧૩મી ડિસેમ્બર સુધી દિલ્હીમાં જોવા મળશે. આગામી ૪૮ પર્વતીય વિસ્તારોમાં થઇ સવારના સમયે ઘુમ્મસવાળું કલાકમાં નાગાલેન્ડ, મણિપુર,

હળવાથી ભારે વરસાદની ગાજિયાબાદમાં

સ્કાયમેટ વેધર મુજબ રહેવાની શક્યતાઓ છે. ઉપરાંત ભારતમાં છૂટો છવાયો વરસાદ

રીઝર્વ બેંકના ગર્વનર શકિતકાંતા

દાસે મહત્વના વિધાનમાં જણાવ્યું

છે. ભારતીય અર્થતંત્ર તેની ગતિ

જાળવવામાં સફળ રહ્યું છે. આગામી

સમયમાં વૈશ્વિક પરિસ્થિતિની અસર

ભારત પર થઇ શકે છે. શકિતકાંતા

દાસના આ વિધાનો મહત્વના છે.

તેઓએ એ પણ જણાવ્યું કે ફગાવો

રહેલ હિમવર્ષાને કારણે ઉત્તર વાતાવરણ રહેશે. દિલ્હી- મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય અને ભારતમાં ઠંડી વધી રહી છે. એનસીઆરના ક્યુઆઇની વાત આસામમાં ધીમોથી ભારે વરસાદ રાજધાની દિલ્હીના તાપમાનમાં કરીએ તો અહીં હાવની ગુણવત્તા થઇ શકે છે. અરુણાચલ પ્રદેશમાં પણ ધીમો વરસાદ થઇ શકે છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ ઉપરાંત ઝારખંડ, બિહાર, જોરદાર પવન ફૂંકાઇ રહ્યું છે. બોર્ડના કહેવા મુજબ દિલ્હીમાં દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ હવામાન વિભાગે આજે એટલે ગુરુવારે ૨૪ વિસ્તારોમાં હવાનું બંગાળ અને લક્ષદ્વીપમાં ધીમા કે ૮મી ડિસેમ્બરના રોજ ઉત્તર સ્તર ખૂબ જ ખરાબ હતું. ગ્રેટર વરસાદની શક્ચતાઓ છે. આ ૨૮૮, સિવાય છત્તીસગઢ, ઓડિશા, ૨૮૪, પૂર્વ મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, નોએડામાં ૨૭૯, ફરીદાબાદમાં તામિલનાડુ, કેરલ અને અંદમાન હવામાન ખાતાની આગાહી ૨૮૫ અને ગુરુગ્રામમાં ૨૩૫ અને નિકોબાર દ્વીપ પર છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.

તેલંગણાના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર લપસી પડતાં હોસ્પિટલમાં દાખલ

હૈદ્રાબાદ, તા.૮ તેલંગાશાના પૂર્વ મુખ્યમંત્રીને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે તેઓ લપસીને પડી ગયા હતા જેના પગલે તેમને પીઠમાં ગંભીર ઈજા પહોંચી હતી. તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર (કેસીઆર) ગઈકાલે લપસીને પડી ગયા હોવાથી હૈદરાબાદની યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને પીઠમાં ગંભીર ઈજા પહોંચી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને સર્જરીની જરૂર પડી શકેં છે. તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામો ૩ ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં કેસીઆરની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ને મોટો ફટકો પડ્યો હતો અને પક્ષ સત્તાથી બહાર થઈ

લિગેર ફિનવેસ્ટ લિમિટેડ ાજિ. ઓફિસ: ૧૪૦૭, ૧૪મો માળ, ચિરંજીવ ટાવર, ૪૩, નેહરુ પ્લેસ, ન્યુ દિલ્હી-૧૧૦૦૧૯ કોર્પોરેટ ઓફિસ: મેક્સ હાઉસ, ૭મે માળે, બ્લોક એ, ડૉ. ઝા માર્ગ, ઓખલા ફેઝ-૩, ઓખલા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, નવી દિલ્હી-૧૧૦૦૨૦

વર્તમાન સ્થિતિને જાળવી રાખવા માટે મકકમ છે.

RELIGARE SME LOANS

ગયો હતો.

ર્ષ્કાંચ ઓફિસઃ૧૦૦૬-૧૦૦૭, શિવાલિક શિલ્પ, ઇસ્કોન ચાર રસ્તા, એસ.જી. હાઇવે, અમદાવાદ-૩૮૦૦૧૫, ગુજરાત CIN:∪74999DL1995PLC064132

એપેન્ડિક્સ-IV-A હરાજી-કમ-વેચાણ નોટિસ

ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ અને સરફૈસી કાયદો,૨૦૦૨ને સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૮(ફ) અને ૯(૧) ની જોગવાઈઓ સાથે વંચાણે લેતા હેઠળ સ્થાવ સંપત્તિઓના વેચાણની હરાજી-કમ-વેચાણ નોટિસ

નીચે વર્ણવેલ સ્થાવર મિલકત જે સિક્યોર્ડ લેણદાર (એટલે કે મે. રેલિગેર ફિનવેસ્ટ લિ. ટુંકમાં આરએફએલ) પાસે ગિરવે/ચાર્જમાં મુકેલ હતી તે સ્થાવર મિલકત (ટૂંકમાં મિલકત)ના હરાજી-કમ-વેચાણ કરવા માટે અત્રે જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેણદાર(રો)/જામીનદાર(રો)/ગિરવેદાર(રો)ને નોટિસ આપવામાં આવે છે. નીચે સહી કરના૨ 'જેમ છે જયાં છે', 'જે કંઈ છે તે છે', 'જે કાંઈ છે તે ત્યાં છે' અને 'કોઈ આશ્રય વિના' ના આધારે નીચે જણાવેલ 'રિઝર્વ કિંમતે' ૦૯-૦૧-૨૦૨૪ ના રોજ બપોરના ૧૨.૩૦ વાગ્યા સુધીમાં (સૂચિત હરાજી/વેચાણ તારીખ), ૨૬-જુલાઈ-૨૦૨૧ મુજબ થતા રૂ ૧,૩૫,૬૭,૭૭૬.૮૫/ -(અંકે રૂપિયા એક કરોડ પાંત્રીસ લાખ સડસઠ હજાર સાતસો છોંતેર અને પૈસા પંચ્યાસી પૂરા)ની જે તે તારીખ સુધીના વ્યાજ, કોસ્ટ્સ અને ચાર્જેસ સાથે જે આરએફએલને દેણદાર(રો)/જામીનદાર(રો)/ગિરવેદાર(રો) નામે શ્રી રામ હોઝિયરી માર્ટ - એના પ્રોપ્રાયટર મારફતે એ-૧, ક્રિષ્ણ શોપિંગ સેન્ટર હેડ પોસ્ટ ઓફિસ સામે દુકાન-૪, પાંચલીમડી, મહેસાણા, ગુજરાત-૩૮૪૦૦૧ ખાતે, વિષ્ણુભાઈ પી. પટેલ તે પ્રહ્લાદભાઈ નરોત્તમદાસ પટેલના દીકરા રહેઃ ૦૧, જય બંગલોઝ, તિરુપતિ શાહીબાગ પાસે, પાંચોટ, મહેસાજ્ઞા, ગુજરાત-૩૮૪૦૦૧, પ્રહ્લાદભાઈ એન. પટેલ તે નરોત્તમદાસના દીકરા રહેઃ ૦૧, જય બંગલોઝ, તિરુપતિ શાહીભાગ પાસે, ગામ પાંચોટ, તાલુકો મહેસાણા, ગુજરાત-૩૮૪૦૦૧, ટિંકલબેન વિનોદભાઈ પટેલ તે વિનોદભાઈન પત્ની રહે.:૦૧, જય બંગલોઝ, તિરુપતિ શાહીબાગ પાસે, પાંચોટ, મહેસાણા, ગુજરાત-૩૮૪૦૦૧, વિનોદકુમાર પ્રહ્લાદભાઈ પટેલ તે પ્રહ્લાદભાઈ નરોત્તમદાસ પટેલના દીકરા શ્રી રામ હોઝિયરી માર્ટના પ્રોપ્રાયટર ૦૧, જય બંગલોઝ, તિરુપતિ શાહીબાગ પાસે, પાંચોટ, મહેસાજ્ઞા, ગુજરાત-૩૮૪૦૦૧ ઉપરાંત શ્રી રામ હોઝિયરી માર્ટ, મારકતે એ-૧, ક્રિષ્ણા શોપિંગ સેન્ટર હેડ પોસ્ટ ઓફિસ સામે દુકાન-૪, પાંચલીમડી, મહેસાજ્ઞા, ગુજરાત-૩૮૪૦૦૧ ખાતે પાસેથી લેવાની થાય છે તેની વસૂલાત માટે વેચાજ્ઞની ઓફર કરે છે કેમ કે ઉપરોક્ત દેણદાર(રો)/જામીનદાર(રો)/ગિરવેદાર(રો) સિક્યોર્ડ લેજ્ઞદારને અધિકૃત અધિકારીએ સરફૈસી કાયદો, ૨૦૦૨ના સેક્શન ૧૩(૨) મુજબ ઇસ્યુ કરેલ તા. ૩૦મી જુલાઈ ૨૦૨૧ની નોટિસ મુજબ તે તારીખથી દિન ૬૦માં લોનની ૨કમ પરત

આથી, સિક્યોર્ડ લેણદારે સરફૈસી કેસ રજિ. નં.૦૪/૨૦૨૨/વશી/ ૧૬૨૭-૧૬૩૨/૨૦૨૨ માં નામદાર કલેક્ટર અને ડી.એમ. મહેસાણાએ તા.૩૧ ૦૫-૨૦૨૨ના રોજ આપેલ આદેશના પાલન અર્થે સદર સરફૈસી કાયદાના સેક્શન ૧૩(૪)ને સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૮ સાથે વંચાણે લેતા મળેલ અધિકારની રૂએ એના અધિકૃત અધિકારી દ્વારા નીચે જણાવેલ ગિરવે મિલકત નં. ૧ અને ૨નો તા.૦૨-૦૫-૨૦૨૩ના રોજ - મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, મહેસાણા (ગ્રામ્ય)ની મદદથી અને મિલકત નં. ૩એ ૪નો ૨૧-૦૯-૨૦૨૩ ના રોજ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, મહેસાણા (શહેર)ની મદદથી ફિઝિકલ કબજો લીધો છે.

આ રીતે સરફૈસી કાયદો, ૨૦૦૨ના સેક્શન ૧૩(૪)ની જોગવાઈઓ હેઠળ લીધેલ કબજો લેવા અંગેની નોટિસ બિઝનેસ સ્ટાન્ડર્ડ (અંગ્રેજી) અને સંદેશ(ગુજરાતી) અખબારોની ૦૫-૦૫-૨૦૨૩ની અને ૨૩-૦૯-૨૦૨૩ની આવૃત્તિઓમાં સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૮(૨) હેઠળ પ્રકાશિત થયેલ છે.

, ૦૦ ૧૦૦૦ તાલા ૧૧૧૦. તેમ જ, દેશદાર(રો)/જામીનદાર(રો)/ગિરવેદાર(રો) આરએફએલને ઉપરોક્ત લોન પરત ચૂકવવામાં નિષ્ફળ ગયા છે, તે પછી પણ સિક્યોર્ડ લેશદારન અધિકૃત અધિકારીએ સૂચિત મિલકત વેચવાનું નક્કી કરેલ છે.

રસ ધરાવતા બીડર(રો) /ખરીદદાર(રો)એ બીડ સાથે હરાજી માટે રિઝર્વ કિંમત દરેક મિલકત સામે નીચે જે તે કોલમમાં દર્શાવેલ છે અને અર્નેસ્ટ મની ડિપોઝીટ (ઈએમડી) રિઝર્વ કિંમતના ૧૦% મુજબ રહેશે જે 'રેલિગેર ફિનવેસ્ટ લિમિટેડ'ની તરફેણમાં ડીડી/પીઓ દ્વારા આરએફએલની શાખા ઓફિસ '૧૦૦૬-૧૦૦૭, શિવાલિક શિલ્પ, ઇસ્કોન ચાર રસ્તા, એસ.જી. હાઇવે, અમદાવાદ-૩૮૦૦૧૫, ગુજરાત' ખાતે ૦૮-૦૧-૨૦૨૪ના સાંજે ૦૫.૦૦ સધીમાં કે તે અગાઉ (બીડ જમા કરાવવાન છેલ્લી તારીખ) જમા કરાવવાની રહેશે. સફળ બીડર /ખરીદદારે (બીડ સાથે ચકવેલ ઈએમડી સહિત) ઓછામાં ઓછા ૨૫% વેચાણકિંમત કાં તો એ જ દિવસે અથવા તે પછીના તરતના કામકાજી દિવસથી મોડું નહીં તેમ જમા કરાવવાની રહેશે. બાકીની રકમ વેચાણ નિર્ધારિ

સ્થાવર મિલકતનું ટૂંકમાં વર્ણન

ક્રમ	મિલકતનું વર્ણન	રિઝર્વ કિંમત	રિઝર્વ કિંમતના એટલે કે ઈએમડી૧૦%
વ	મોજે પાંચોટ, તાલુકો મહેસાણા, જિલ્લો અને રજિસ્ટ્રેશન પેટા જિલ્લો મહેસાણા, ગુજરાતમાં સર્વે નં.૧પ૪૧ધારક જમીન પર આવેલ જય બંગલો નામની સ્કિમમાં પ્લોટ નં.૧ધારક મિલકત અને એની પરનું બાંધકામ, માપણી ૧૪૮.૭૫ ચો.મી. અને એની પરનું બાંધકામ આ મિલકતના તમામ હક્કહિસ્સા. જેની સીમાઓઃ ઉત્તરઃ પ્લોટ નં.૨, દક્ષિણઃ માર્જિન, પૂર્વઃ ઇન્ટરનલ રોડ, પશ્ચિમઃ સર્વે નં.૧૫૪૦.	(રૂ.૪૮,૬૦,૦૦૦/-) અંકે રૂપિયા અડતાલીસ લાખ સાઠ હજાર પૂરા	(રૂ.૪,૮૬,૦૦૦/-) અંકે રૂપિયા ચાર લાખ છચાસી હજાર પૂરા
v	મોજે પાંચોટ, તાલુકો મહેસાણા, જિલ્લો અને રજિસ્ટ્રેશન પેટા જિલ્લો મહેસાણા, ગુજરાતમાં સર્વે નં.૧પ૩૫ધારક જમીન પર આવેલ પુષ્પવાટિકા નામની સ્કિમમાં પ્લોટ નં. નં.૧૪ ધારક મિલકત માપણી ૯૬.૩૨ ચો.મી. અને એની પરનું બાંધકામ માપણી ૩૦.૮૧ ચો.મી.આ મિલકતના તમામ હક્કહિસ્સા. સીમાઓઃ ઉત્તરઃ ઈન્ટરનલ રોડ, દક્ષિણઃ સર્વે નં.૧પ૩૪, પૂર્વઃ સર્વે નં.૧પ૩૭ નું માર્જિન, ઈન્ટરનલ રોડ, પશ્ચિમઃ બ્લોક નં.૧૩ની કોમન દીવાલ.	(રૂ.૨૯,૧૬,૦૦૦/-) અંકે રૂપિયા ઓગણત્રીસ લાખ સોળ હજાર પૂરા	(રૂ.૨,૯૧,૬૦૦/-) અંકે રૂપિયા બે લાખ એકાણું હજાર છસો પૂરા
σ	મોજે મહેસાણા, તાલુકો મહેસાણા, જિલ્લો અને રજિસ્ટ્રેશન પેટા જિલ્લો મહેસાણા, ગુજરાતમાં સર્વે નં.૨૦૦૪/૩૬૦ ધારક (સિટી સર્વે નં. ૩૯૨૫ અને ૩૯૨૬) બિન-ખેત જમીન પર આવેલ ક્રિપ્ણા શોપ સેન્ટર નામની સ્ક્રિમમાં કાંત ગોવિંદ ઓનર્સ એસોસિએશનના સભ્ય તરીકે દુકાન નં.૧ માપણી ૧૩.૦૫ ચો.મી. અને દુકાન નં.૨ માપણી ૧૯.૪૧ ચો.મી. ભોયતળિયે કુલ માપણી ૩૨.૪૬ ચો.મી. આ મિલકતના તમામ હક્કહિસ્સા. સીમાઓઃ ઉત્તરેઃ પેસેજ, દક્ષિણેઃ અન્ય દુકાન સાથેની કોમન દીવાલ, પૂર્વેઃ ઇન્ટરનલ રોડ, પશ્ચિમેઃ દુકાન નં. ૩ની દીવાલ.	(રૂ.૩૫,૫૬,૦૦૦/-) અંકે રૂપિયા પાંત્રીસ લાખ છપ્પન હજાર પૂરા	(રૂ.૩,૮૫,૬૦૦/-) અંકે રૂપિયા ત્રણ લાખ પંચ્યાસી હજાર છસો પૂરા
8	મોજે મહેસાણા, તાલુકો મહેસાણા, જિલ્લો અને રજિસ્ટ્રેશન પેટા જિલ્લો મહેસાણા, ગુજરાતમાં સર્વે નં.૨૦૦૪/૩૬૦ ધારક (સિટી સર્વે નં. ૩૯૨૫ અને ૩૯૨૬) બિન-ખેત જમીન પર આવેલ ક્રિપ્ણા શોપ સેન્ટર નામની સ્ક્રિમમાં કાંત ગોવિંદ ઓનર્સ એસોસિએશનના સભ્ય તરીકે દુકાન નં.૪/એ માપણી ૧૪.૨૧ ચો. મી.ભોયતિથિયે આ મિલકતના તમામ હક્કહિસ્સા. સીમાઓઃ ઉત્તરેઃ આ દુકાનના શટર પછી પેસેજ ગેલેરી, દક્ષિણેઃ અન્ય દુકાન સાથેની કોમન દીવાલ, પૂર્વેઃ દુકાન નં. ૩/એ સાથેની કોમન દીવાલ.	(રૂ.૨૧,૦૭,૦૦૦/-) અંકે રૂપિયા એકવીસ લાખ સાત હજાર પૂરા	(રૂ.૨,૧૦,૭૦૦/-) અંકે રૂપિયા બે લાખ દસ હજાર સાતસો પૂરા

સિક્યોર્ડ એસેટનો પ્રકાર- ફ્રિહોલ્ડ

થયાની તારીખથી દિન ૧૫માં જમા કરાવવાની રહેશે.

જાણીતાં કરભારણઃ

આરએફએલને વેચાણ માટે મૂકાયેલ સિક્યોર્ડ એસેટના આરએફએલ સિવાયના કાયદાકીય કરભારણો હોય તો જાણ નથી. રસ ધરાવતી પાર્ટીઓએ પોતાની રીતે પોતાના સંતોષ ખાતર સિક્યોર્ડ એસેટની ચકાચણી કરાવી લેવી. સિક્યોર્ડ ક્રેડિટર (આરએફએલ) ઉપરોક્ત સિક્યોર્ડ એસેટના સંદર્ભમાં ફિટનેસ/ટાઇટલની કોર્દ પણ રીતે કોઈ રજૂઆત કરતા નથી.

વેચાણના વિગતવાર નિયમો અને શરતો માટે મહેરબાની કરીને આરએફએલ(સિક્યોર્ડ ક્રેડિટર)ની વેબસાઇટ એટલે કે https://www.religarefinvest.cc Auctionpage.aspx પર આપેલ લિંક /યુઆરએલ જોવાં.

નોંધઃ પૂર્વગ્રહ વિના મિલકત હરાજી માટે રાખવામાં આવેલ છે અને તે શ્રી રામ હોઝિયરી માર્ટ અને અન્યો દ્વારા રેલિગેર ફિનવેસ્ટ લિ. વિરુદ્ધ ફાઈલ કરવામ આવેલ સિક્યોરિટાઇઝેશન અરજી નં .૧૧૬ ઓફ ૨૦૨૩ અને શ્રી ભાઈલાલભાઈ વિકલદાસ પટેલ દ્વારા રેલિગેર ફિનવેસ્ટ લિ . અને અન્યો વિરુદ્ધ ફાઈલ કરવામાં આવેલ સિક્યોરિટાઇઝેશન અરજી નં.૨૩૩ ઓફ ૨૦૨૩માં નામદાર ઋણ વસૂલી અધિકરણ (ડેબ્ટરિકવરી ટ્રિબ્યુનલ-ડીઆરટીં) અમદાવાદના નિર્ણયને અધીન

વધુ માહિતી માટે મહેરબાની કરીને શ્રી.અંકિત દેસાઈનો એમના મોબાઇલ નં.૯૮૨૪૨૫૪૦૪૦ અથવા એમના ઈ-મેઇલ આઇડીઃ ankit.desai@religare.con પર અને શ્રી અભિષેક કુમાર શુક્લનો એમના મોબાઇલ નં.૭૩૦૩૭૪૧૧૯૯અથવા એમના ઈ-મેઇલ abhishek.shukla1@religare.com પર સંપર્ક કરવો

તા. ૦૭-૧૨-૨૦૨૩ અધિકૃત અધિકારી રેલિગેર ફિનવેસ્ટ લિમિટેડ સ્થળઃ ગુજરાત



ગુજરાતની જેમ ઉત્તરાખંડમાં પણ ભાજપ સરકારે વાયબ્રન્ટ સમીટનું આયોજન કર્યું છે જો કે તેને ઉત્તરાખંડ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-૨૦૨૩ એવું નામ આપવામાં આવ્યું છે, ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્મૃતિ ચિહ્ન ભેટ આપ્યું તે પ્રસંગની તસ્વીરમાં વડાપ્રધાન ભેટ સોગાદને નિહાળી

ભાજપે ત્રણ રાજ્યો માટે નિરક્ષકો જાહેર કર્યા, કાલ સુધીમાં સીએમનો નિર્ણય

નવી દિલ્હી, તા.૮ વિનોદ તાવડે અને સરોજ પાંડેને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને રાજસ્થાનના વિચારણાં ચાલી રહી છે.

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, બનાવાયા છે.

છત્તીસગઢમાં વિધાનસભા (ભાજપનાનિરક્ષકો) બનાવાયા ચંટણીમાં ભાજપના વિજય છે. જ્યારે હરિયાણાના સીએમ બાદથી આ રાજ્યોમાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, કે.લક્ષ્મણ, પદ કોને સોંપાશે તે મુદ્દે ચર્ચા આશા લકડાને મધ્યપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી આ સૌની વચ્ચે ભાજપે આ હતી. જયારે છત્તીસગઢ માટે ત્રણેય રાજ્યો માટે નિરીક્ષકોના અર્જુન મુંડા, સર્બાનંદ સોનોવાલ નામની જાહેરાત કરી દીધી છે. અને દુષ્યંત ગૌતમને નિરીક્ષક

જલતરંગ એસ.બી.આઈ સોસાયટી, જીવરાજ પાર્ક, વેજલપુર રોડ, અમુદાવાદ-૩૮૦૦૫૧માં આવેલ બંગલા નંબર ૨૩/બી વાળી મીલકતના શેર સર્ટીફીકેટ મારા પિતાશ્રી **દિલીપભાઇ આચાર્ચની** માલિકીવાળી ખોવાઈ ગયેલ છે. તેથી ડુપ્લીકેટ શેર સર્ટીફીકેટ ઉપર કે સૃદર મિલકત ઉપર જે કોઈનો હક્ક, દાવો, લાગભાગ, લીયન, બોજો, ચાર્જ કે અન્ય કોઈપણ પ્રકારનો હક્ક, હિસ્સો હોય તો તેઓએ નોટીસ પ્રસિધ્ધ થયેલી દિવસ-૭માં હાંડા, હિંદુ માં તાલાના મારા કર્યા હવા કર્યા હવા કર્યા ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર રહેશે નહીં. જેથી જાહેર તરૂણકુમાર આચાર્ચ C/o દિલીપભાઈ આચાર્ચ

૨૩/બી, જલતરંગ એચ.બી.આઈ સોસાયટી, જીવરાજ પાર્ક, વેજલપુર રોડ, અમદાવાદ-૩૮૦૦૫૧

જાહેર નોટીસ ડીસ્ટ્રીક્ટ અમદાવાદ, સબ-ડીસ્ટ્રીક્ટ અમદાવાદ તાલુકો: અસારવા (નિકોલ-૧૨)ના મોજે ગામ નિકોલની સીમના સર્વે / બ્લોક નં. ૧૪૫/૧/૨/૧ ની પદદપ ચો.મી. જમીનનો સમાવેશ ટાઉન પ્લાનીંગ સ્ક્રીમ નં. ૧૦૩માં થતા ફાળવવામાં આવેલ ફાઇનલ પ્લોટ નં. ૧૩/૩ની ૨૦૦૦ ચો.મી. મલ્ટી પર્પઝ હેતુની તથા ૧૩૯૯ ચો.મી. વાણિજ્ય હેતુની એમ મળી કુલ ૩૩૯૯ ચો.મી.ના ક્ષેત્રફળ વાળી બિનખેતીની જમીન REVTI INFRA એ નામની ભાગીદારી પેઢીની માલિકી, કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજાઓથી મુક્ત આવેલ છે. તેમ જણાવી તેઓએ અમારી પાસે સદર જમીનના ટાઇટલ્સ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે.

ઉપરોક્ત જમીનમાં અન્ય કોઇપણ શખ્સનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત હિસ્સો પોષાતો હોય તો આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૭માં નીચે જણાવેલ સરનામે પુરાવા સહિત રજી. એડી.થી જાણ કરવી અને જો તેમ કરવામાં કસુર થશે તો તેવી વ્યક્તિએ તેમના હક્કો જતા કરેલ તેમ સમજીને અમો સદરહું જમીનનું ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઇસ્યુ કરી દઇશુ, ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી જેની લાગતા વળગતાએ નોંધ લેવી. અમદાવાદ. તા. ૮-૧૨-૨૦૨૩

પ્રહલાદ એસ. પટેલ (એડવોકેટ એન્ડ નોટરી)

એફ-એફ-૩-૪, શ્યામ દર્શન શોપીંગ સેન્ટર, શીવાજી ચોક પાસે, હરીધામ હરિવિલા રોડ, નરોડા, અમદાવાદ. મો.: 9898048453 દારૂબંધીના મુદ્દે હવે રાજકારણ ગરમાયું

મદ્દે કોઈ પણ સરકાર ગમે તેવો નિર્ણય કરતાં પહેલાં અનેકવાર વિચારે છે. ટેક્સની દષ્ટિએ આ સરકાર માટે કમાણીનો મોટો સોર્સ હોય છે. જ્યારે લોકો માટે આ ભાવનાત્મક મુદ્દો છે. એટલે જ બિહારમાં નીતીશ કુમારે મહિલાઓની માર્ગ પર દારૂબંધીની જાહેરાત કરી હતી.

દારૂબંધી એક અતિ દારૂબંધીનો કાયદો ખતમ કરી સંવેદનશીલ મુદ્દો ગણાય છે. આ દેવાયો છે. તેના બાદ બિહારમાં

કેબિનેટે રાજ્યની મહેસુલી આવક વધારવા અને ઝેરીલા દારૂની સપ્લાય રોકવા માટે લીકર પોલિસીમાં ફેરબદલ કર્યા

આ મુદ્દે હવે રાજકારણ જ રમાય પણ ફરી એવી માગ થવા લાગી છે. જોકે આ સૌની વચ્ચે મણિપુર છે. મણિપુરમાં ભાજપની સરકારે

ઈમ્ફાલ, તા.૮ એક એવું રાજ્ય છે જ્યાં ૩૦ વર્ષથી વધુ સમયથી અમલી દારૂ પરનો પ્રતિબંધ ઊઠાવી લેવાનો નિર્ણય કર્યો છે. કેબિનેટે રાજ્યની મહેસૂલી આવક વધારવા અને ઝેરીલા દારૂની સપ્લાય રોકવા માટે લીકર પોલિસીમાં ફેરબદલ કર્યા છે. મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહના નેતૃત્વ હેઠળની કેબિનેટે રાજ્યમાં ૩૦ વર્ષથી વધુ સમયગાળાના પ્રતિબંધ બાદ દારૂના ઉત્પાદન, કબજા, નિકાસ, આયાત, પરિવહન, ખરીદી, વેચાણ અનેવપરાશને મંજૂરી આપી દીધી છે.

THE HOFE BANK એચડીએફસી બેન્ક લિમિટેડ

એયડીએફસી હાઉસ, મીઠાખળી છ રસ્તા પાસે, નવરંગપુરા, અમદાવાદ. ફોન : (૦૯૯) દુદ્ ૩૦૯૦૦૦ એચડીએફસી બેન્ક લિમિટેડના (ભૂતકાળમાં એચડીએફસી લિ., જેનું નામદાર એનસીએલટી-મુંબઇ ના તારીખ ૧૭ માર્ચ, ૨૦૨૩ ના આદેશ મુજબ મંજૂર થયેલ એકીકરણ યોજના અનુસાર **એથડીએફસી બેન્ક લિમિટેડ** સાથે એકીકરણ થયેલ છે**) (એથડીએફસી)** અધિકૃત અધિકારીઓ સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ કલમ ૧૩(૧૨) સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ ના રૂલ ૩ સાથે વાંચતા સત્તાને આધિન રહી ઉપરોક્ત એક્ટની કલમ ૧૩(૨) હેઠળ નીચેના બોરોઅર/કાયદેસરના વારસ(સો) અને કાયદેસરના પ્રતિનિધિ(ઓ)ને ડિમાન્ડ નોટિસ પાઠવવામાં આવેલ, જે અનુસાર તેમના જે તે નામ સામે દર્શાવેલ રકમ સહિત નોટિસમાં દર્શાવાયેલ તે રકમ ઉપરનું વ્યાજ, નોટિસ તારીખથી ૯૦ દિવસમાં ચૂકવી આપવા જજ્ઞાવાયેલ છે. જે મુજબ પ્રાસંગિક ખર્ચા, અન્ય ખર્ચા. ચાર્જિસ વગેરે ચકવી અને/અથવા જમા થાય ત્યાં સધીના આપવાના રહેશે.

रमनु. नं.	બોરોઅર/કાયદેસરનાં વારસદાર(રો) અને કાયદેસરના પ્રતિનિધિ(ઓ)નાં નામ	તારીખના રોજ બાકી લેણાં* રૂા.	ડિમાન્ડ નોટિસ તારીખ	પઝેશન તારીખ ફીઝિકલ/ સિમ્બોલીક	રથાવર મિલકત(તો) / સલામત અસ્ક્યામત(તો) નું વર્ણન
(એ)	(બી)	(સી)	(શ)	(&)	(એફ)
9	પત્ની/ પુત્ર/ પતિ / પુત્રી - શ્રી સુરેશભાઇ મણિલાલ પટણી (અવસાન પામેલ છે) અને અથ્ય જાણમાં હોય/ જાણમાં ના હોય તેવા કાયદેસરના પારસદાર(રો), કાયદેસરના પ્રતિનિદિ(ઓ), અનુગામીઓ અને અસાઇન્સ શ્રી સુરેશભાઇ મણિલાલ પટણી (અવસાન પામેલ છે) (ઓરોઅર) શ્રીમતી ઉંષાબેન સુરેશભાઇ પટણી (ક્રો-બોરોઅર)	રા. ૧૩,૯૪,૪૦૫/- ૩૧ જુલાઇ, ૨૦૨૨ ના રોજ°	૧૮ ઓગ., ૨૦૨૨	દુ કિરો., ૨૦૨૩ (ફીડિઇકલ પ્રઝેશન)	ફ્લેટ - સી/ર૦ર, બીજો માળ, સહજાનંદ એવન્યુ બ્લોક - સી, સ. નં. રફ૦/ર, ટીપી નં. ૧૧૮, એક્પી નં. ૧૪૨, સિગ્નેચર પ્રાઇડ પાસે, સોમનાથ સોસાયટી પાછળ, રામદેવપીર મંદિર સામે, સિંગરવા ગામ, અમદાવાદ-૩૮૨૪૧૫.

' લાગુ પડતા વધારાના વ્યાજ સાથે, પ્રાસંગિક ખર્ચા, ચાર્જિસ વગેરે ચૂકવશી/ જમા થાય ત્યાં સુધીના ગણાશે.

જો કે, અહીં ઉપર દર્શાવેલ બોરોઅર/કાયદેસરના વારસદાર(રો) અને કાયદેસરના પ્રતિનિધિ(ઓ) બાકી લેશી નીકળતી રકમ ચૂકવવામાં નિષ્ફળ ાયેલ છે. તેથી આ સાથે ઉપરોક્ત બોરોઅર/ કાયદેસરના વારસદાર(રો) અને કાયદેસરના પ્રતિનિધિ(ઓ)ને વ્યક્તિગત રીતે અને જાહેર જનતાને સૂચના આપવામાં આવે છે કે, **એચડીએફસી**ના અધિકૃત અધિકારી/ઓ (ભૂતકાળમાં **એચડીએફસી લિ**. , જેનું નામદાર એનસીએલટી, મુંબઇના તારીખ ૧૭ માર્ચ, ૨૦૨૩ ના આદેશ મુજબ મંજૂર થયેલ એકીકરણ યોજના અનુસાર **એચકીએક્સી બેન્ક લિમિટેડ** સાથે એકીકરણ થયેલ છે) દ્વારા ઉપરોક્ત એક્ટની કલમ ૧૩ (૪) હેઠળ અને ઉપરોક્ત નિયમના નિયમ-૮ સાથે વાંચતા મળેલ સત્તાને આધિન રહી, ઉપરોક્ત તારીખોએ અહીં ઉપર દર્શાવેલ સ્થાયી પ્રોપર્ટી/ સિક્યોર્ડ એસેટનો કબજો મેળવી લેવામાં આવેલ છે.

અહીં ઉપરોક્ત બોરોઅર/ કાયદેસરના વારસો અને કાયદેસરના પ્રતિનિધિ(ઓ) ને વ્યક્તિગત રીતે અને જાહેર જનતાને આ સાથે સાવધાન કરવામાં આવે છે કે ઉપરોક્ત સ્થાયી પ્રોપર્ટી/સિક્યોર્ડ એસેટ સાથેનો કોઈ સોદો કરાશે તો તે **એચડીએફસી બેન્ક લિમિટેડ**ના ગિરો હક્કને આવિન રહેશે. બોરોઅર(ર્સ)/ કાયદેસરના વારસ (દારો), કાયદેસરના પ્રતિનિધિ(ઓ)નું ધ્યાન દોરવામાં આવે છે કે એક્ટની કલમ-૧૩ ની પેટા કલમ(૮) ની

જોગવાઇ અનુસાર સમય રહેતાં પોતાની સલામત અસ્કયામત/તો છોડાવી લે. કરવામાં આવેલ પંચનામું અને તૈયાર કરાયેલ ઇન્વેન્ટરી નીચે સહી કરનાર પાસે ઉપલબ્ધ છે; અને ઉપરોક્ત બોરોઅર(સી)/ કાયદેસરના વારસદાર(રો)/ કાયદેસરના પ્રતિનિધિ(ઓ) ને વિનંતી છે કે તે નકલ નીચે સહી કરનાર પાસેથી કામકાજના દિવસોએ કામકાજના સમય દરમિયાન મેળવી

તારીખ : ૦૮-૧૨-૨૦૨૩

અધિકૃત અધિકારી



SUZLON ENERGY LIMITED

Registered Office: "Suzlon", 5, Shrimali Society Near Shri Krishna Complex, Navrangpura, Ahmedabad 380 009, Gujarat, India; Tel: +91 79 6604 5000 Corporate Office: One Earth, Hadapsar, Pune 411 028, Maharashtra, India; Tel: +91 20 6702 2000

Contact Person: Geetanjali S.Vaidya, Company Secretary and Compliance Officer E-mail: investors@suzlon.com; Website: www.suzlon.com Corporate Identity Number: L40100GJ1995PLC025447

This is only an Advertisement for the information purpose and not for publication, distribution, or release, directly or indirectly, in the United States of America or otherwise outside India. This is not an offer document. All capitalised terms used and not defined herein shall have the meaning assigned to them in the Letter of Offer dated 28th September 2022 read with addendum dated 10th October 2022 filed with BSE Limited ('BSE') and the National Stock Exchange of India Limited ('NSE'), the stock exchanges where the Equity Shares of the Company are presently listed (BSE and NSE hereinafter together referred to as the "Stock Exchanges") and Securities and Exchange Board of India ('SEBI').

SECOND REMINDER-CUM-FORFEITURE NOTICE TO THE HOLDERS OF PARTLY PAID-UP **EQUTIY SHARES ON WHICH CALL MONEY IS TO BE PAID (ISIN: IN9040H01011)**

In terms of provisions of the Companies Act, 2013 ('Act'), read with the relevant rules made thereunder, the First and Final Call Notice had been issued to such persons who were members of the Company on 2nd March 2023, being the Record Date. The call payment period has since expired on 23nd March 2023.

In this connection, the Securities Issue Committee of the Board of Directors of the Company (the "Committee"), duly authorised by the Board of Directors of the Company, at its meeting held on 29th March 2023, approved sending Reminder-cum-Forfeiture Notice from time to time for payment of the First and Final Call amount of ₹2.50 per partly paid-up equity share (comprising ₹1.00 towards face value and ₹1.50 towards securities premium), to the holders of such partly paid-up equity shares on which the First and Final Call Money remains unpaid.

Accordingly, the Company has sent the Second Reminder-cum-Forfeiture Notice to the shareholders who have not paid the call money.

The payment of the First and Final Call has to be made immediately but not later than 26th December 2023 using any of the following modes:

- a. For payment by net-banking / UPI through the R-WAP facility provided by KFin Visit weblink https://rights.kfintech.com/callmoney/ and proceed to make payment. Kindly note that the interest amount is pre-computed when you make payment through the R-WAP.
- b. For payment through DD, the details are as under:
 - i. DD to be drawn in favour of: SUZLON ENERGY LIMITED RIGHT ALLOTMENT ACCOUNT
 - ii. DD payable at: Hyderabad or at par
 - iii. DD to be accompanied by Payment Slip containing details such as Name, DPID-Client ID, No. of shares, Amount, DD date and Number, Name of Bank
 - iv. DD along with the payment slip to be sent to: KFin Technologies Limited, (Unit: Suzion Energy Limited), Selenium Tower B, Plot No.31 and 32, Financial District, Nanakramguda, Rangareddi-500032, Telangana, India.

 $The payment slip and detailed instructions for payment of Call Money are available on the website of the Company at \underline{www.suzlon.com} \ and \ / \ or \ on \ web \ link$ of Kfin Technologies Limited at https://rights.kfintech.com/callmoney/. Please read the same carefully before proceeding for payment.

Please note that, failure to pay the First and Final Call Money, as aforesaid, shall render the partly paid-up equity shares of the Company, including the amount already paid thereon, liable to be forfeited in accordance with the provisions of the Act, the Articles of Association of the Company and the Letter of Offer. Further, interest @ 8.00% (Eight per cent only) p.a. will continue to be charged for delay in payment of the First and Final Call from 24th March 2023 till date of the actual payment of the First and Final Call. The Company shall be entitled to deduct from any dividend payable to such members, if any, all sums of money outstanding on account of calls and interest due thereon in relation to the partly paid-up equity shares of the Company.

All correspondence in this regard may be addressed to: KFin Technologies Limited, Unit: Suzlon Energy Limited, Selenium Tower B, Plot No.31 and 32, Financial District, Nanakramguda, Rangareddi-500032, Telangana, India; Contact person: Mr. M. Murali Krishna Tel: +91 40 6716 2222; Toll Free No. 1800 309 4001 (operational from Monday to Saturday between 9 a.m. and 5 p.m.) E-mail id: einward.ris@kfintech.com.

> For Suzion Energy Limited Geetanjali S.Vaidya,

Date: 8th December 2023













